

આણંદ-વલ્લભ વિધાનગર-કરમસદ શહેરી વિકાસ સત્તામંડળ, આણંદ
AVKUDA

જુની પ્રાંત કચેરી, અમુલ ડેરી રોડ, તા.જિ.આણંદ-૩૮૮૦૦૧

ફોન નં.(૦૨૬૯૨) ૨૪૨૨૦૪

E mail id - avkudaand@gmail.com

નમુનો :- ધ

નિયમ-૧૦

બાંધકામ માટે પરવાનગી

(આ મંજૂરી માલિકીનો પુરાવો નથી, તે માટે કલેક્ટરશ્રીનો નિર્ણય આખરી ગણાશે.)

પ્રતિ,

શ્રી જયેશકુમાર જશભાઈ પટેલ
ઠે.૩/જી, વૈભવ કોર્મશીયલ સેન્ટર,
ગ્રીડ પાસે, મુ.પો.આણંદ,
તા.જિ.આણંદ

વિષય :-

મોજે - કરમસદ, તા.જિ.આણંદના રે.સ.નં. ૧૦૮૭/૨/પેકી/૨ માં રહેણાંક/શોપ હેતુ માટેની બાંધકામ પરવાનગી આપવા બાબત.

સંદર્ભ :-

આપશ્રીની તારીખ ૧૮/૦૧/૨૦૧૮ ની અરજી અન્વયે.

ઉપરોક્ત વિષય પરત્વે સંદર્ભ હેઠળની અરજી અન્વયે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ (સન.૧૯૭૬ ના રાષ્ટ્રપતિ અધિનિયમ નં.૨૭) ની કલમ-૨૯(૧)(૧), ૨૯(૧)(૨), ૨૯(૧)(૩), ૩૪ અને ૪૯(૧)(ખ) હેઠળ મોજે ગામ : કરમસદ, તાલુકો : આણંદ, જિલ્લો : આણંદના રે.સ.નં. ૧૦૮૭/૨/પેકી/૨, ક્ષેત્રફળ ૫૫૧૩.૦૦ ચો.મી. જમીનમાંથી રોડ કટીંગ ૭૨૦.૦૦ ચો.મી. + સેટબેક માજિનની કપાત ૩૮૩.૦૦ ચો.મી. એમ કુલ ૧૧૦૩.૦૦ ચો.મી. બાદ કરતા બાકી રહેતી ૪૪૧૦.૦૦ જમીનમાં તેમની હદમાં નીચે વર્ણન કર્યા મુજબ રહેણાંક/શોપ હેતુ માટે આ સાથેની શરતોને આધિન બાંધકામની પરવાનગી આપવામાં આવે છે.

કામનું વર્ણન :-

અ.નં.	ફ્લોર (માળ)	બાંધકામમાં (બિલ્ડઅપ) નું ઉપયોગી ક્ષેત્રફળ (ચો.મી.)	બાંધકામનો ઉપયોગ	એકમની સંખ્યા	રીમાર્ક્સ
૧.	૨.	૩.	૪.	૫.	૬.
૧	ગ્રાઉન્ડ ફ્લોર	૧૦૦૦.૬૦ (પ્રપોઝ)	રહેણાંક/શોપ	-	-
૨	ફર્સ્ટ ફ્લોર	૧૦૦૦.૬૦ (પ્રપોઝ)	રહેણાંક/શોપ	-	-
૩	સ્ટેર કેબીન	૦૧૫૮.૮૭ (પ્રપોઝ)	સ્ટેર કેબીન	-	-
	કુલ	૨૧૬૦.૧૭			

અગાઉ અત્રેના પત્ર ક્રમાંક :વિ.પ/ - /૨૦૧૪ તા.----- / ----- /૨૦૧૪ થી અપાયેલ વિકાસ પરવાનગી આથી રદ ગણવાની રહેશે.

ક્રમાંક-અવકુડા/વિ.પ/ ૧૪ /૨૦૧૮

તા. ૦૪/૦૧ /૨૦૧૮

ખાસ શરતો :-

- (૧) આ વિકાસ પરવાનગીથી કોમ્પ્રીહેન્સીવ જી.ડી.સી.આર.ના વિનિમયો મુજબ ફક્ત બાંધકામ માટેની જ પરવાનગી મળે છે. અન્ય લાગુ પડતા કાયદા/નિયમો અન્વયે પરવાનગી મળતી નથી.
- (૨) સત્તામંડળ તરફથી બાંધકામની પરવાનગી મેળવ્યા બાદ જ બાંધકામ શરૂ કરવાનું રહેશે તેમજ સરકારશ્રીના તા.૧૨/૧૦/૨૦૧૭ ના જાહેરનામાં મુજબ મંજૂર થયેલ કોમ્પ્રીહેન્સીવ જી.ડી.સી.આર.માં જણાવ્યા મુજબ તબક્કાવાર બાંધકામ અંગેનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે.
- (૩) જી.ડી.સી.આર.ની જોગવાઈ તથા સરકારીશ્રીના તા.૨૮/૦૫/૨૦૦૧ ના સ્ટ્રક્ચરલ સેફ્ટી અંગેના હુકમના વિનિયમ નં.૩ અનુસાર બાંધકામ સ્થળની જરૂરીયાતોની જોગવાઈઓનું પાલન થયેથી જ સ્થળ ઉપર બાંધકામ કરવાનું રહેશે.
- (૪) સેપ્ટીક ટેક તથા સોકવેલની સાઈઝ તથા સંખ્યા નેશનલ બિલ્ડીંગ કોડ (આઈ.એસ.૨૪૭૦) તથા સિવિલ એન્જનીયરીંગ હેન્ડબુક બાયલોઝ મુજબ ડ્રેનેજ લે-આઉટમાં દર્શાવાનાં રહેશે અને તે અનુસાર જોગવાઈ કરવાની જવાબદારી આર્કિટેક્ટ /ઈજનેર/ સ્ટ્રક્ચરલ એન્જનીયર / ક્લાર્ક /સુપરવાઈઝર / ડેવલોપર્સ / જમીન માલિકની રહેશે.
- (૫) વિકાસ પરવાનગી પત્ર તથા મંજૂર થયેલ નકશાઓનો એક સેટ સ્થળ પર પ્રસિધ્ધ કરવાનો રહેશે.
- (૬) બાંધકામ પૂર્ણ થયા બાદ બાંધકામનો ઉપયોગ શરૂ કરતા પહેલા નિયમોનુસાર અત્રેથી બાંધકામનું વપરાશ અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ વપરાશ શરૂ કરવાનું રહેશે.
- (૭) જી.ડી.સી.આર.ની જોગવાઈઓ મુજબ મેન્ડટરી ડીસ્ક્લોઝરની જોગવાઈઓ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- (૮) નકશામાં દર્શાવ્યા મુજબ માપો સ્થળે જાળવવાના રહેશે.

અન્ય શરતો :-

- (૧) શહેરી ટોચમર્યાદા અને નિયમન અધિનિયમ-૧૯૭૬ અન્વયે કોમ્પીટન્ટ ઓથોરીટી પાસેથી જરૂરી ના-વાંધા પ્રમાણપત્ર જરૂર જણાયે મેળવવાની જવાબદારી અરજદારની રહેશે.
- (૨) સદરહુ જમીનમાં બીનાખેતીનો ઉપયોગ કરતા પહેલા અન્ય કાયદા હેઠળ પરવાનગી લેવાની થતી હોય તો તે મેળવી લેવાની જવાબદારી અરજદારની રહેશે.
- (૩) વિકાસ કામની પરવાનગી અર્થે સર્વે નંબર/અથવા અંતિમ ખંડ અગર પ્લોટમાં અરજદાર જે જમીનમાં માલિક છે તે જમીન પુરતી પરવાનગી આપવામાં આવેલ છે.
- (૪) વિકાસ નકશા અને નગર રચના યોજનાની જુદા જુદા વિસ્તારમાં જમીનો અને મકાનોના ઉપયોગ વિશે જે ખાસ નિયમો હશે તેના વિરૂધ્ધનો ઉપયોગ કરી શકાશે નહીં.
- (૫) મંજૂર નંબરમાં બતાવેલી જમીનમાંથી "અવકુડા" એ કંઈક જમીન લીધી હશે અગર કોઈ ભાગ છોડાવવા હુકમ કરેલો હશે અગર સનદ સિવાયના કોઈ ભાગ "અવકુડા" એ કબજો કર્યા હશે તે સિવાયના ભાગ માટે વિકાસ પરવાનગી પાત્ર સમજવાનો રહેશે તથા આ પરવાનગી અધિકૃત સનદના માપને આધીન રહીને આપેલ ગણાશે.
- (૬) અરજદારે નિયમોનુસાર ભરવાનો થતો વિકાસ ચાર્જ સત્તામંડળ નક્કી કરે તે ભરવાનો રહેશે.
- (૭) માલિકને વિકાસ માટેની પરવાનગી આપવામાં આવી હશે તો પણ તેમણે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ મુજબ નગર રચના યોજના માટે ફાળો આપવાનો રહેશે.
- (૮) વિકાસ પરવાનગી આણંદ-વલ્લભ વિધાનસભા-કરમસદ શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તાર માટે સરકારશ્રીના તા.૧૨/૧૦/૨૦૧૭ ના રોજ મંજૂર કરેલ કોમ્પ્રીહેન્સીવ જી.ડી.સી.આર. મુજબ આપવામાં આવી છે. અને ખાનગી હકોના નુકશાન અંગે સત્તામંડળ કંઈપણ જવાબદારી લેતી નથી.
- (૯) આ વિકાસ પરવાનગી પત્ર તથા મંજૂર થયેલ નકશા સત્તામંડળના અધિકૃત અધિકારી / કર્મચારી જોવા માગે તો તેમને બતાવવા માલિક બંધાવેલ છે તે નહીં બતાવશે તો બાંધકામ બંધ કરવા હુકમ કરશે તે મુજબ બંધ કરવું પડશે.
- (૧૦) રસ્તા ઉપર ઈમારતી સામાન અગર પુરણી પ્રથમથી મંજૂરી મેળવ્યા સિવાય નાખવી નહીં. મંજૂરીથી નાખેલ પુરણી વિગેરે અંગે વ્યવસ્થિત જોઈતું કોર્ડન કરી, ટ્રાફિકને અડચણ ન થાય તેમ નાખવી.

- (૧૧) બાંધકામ લેન્ડ એકવીઝેશન એક્ટ-૧૯૮૪ મુજબ એકવાયર કરવાને સદર એક્ટની કલમ-૪ અન્વયે નોટીફિકેશન નિકળ્યા હશે તો એકવીઝેશન એક્ટ-૨૪ (૨૭) મુજબ મે.કલેક્ટર સાહેબની મંજૂરી બાંધકામ શરૂ કરતા પહેલા લેવાની રહેશે.
- (૧૨) જો પ્રશ્નવાળી જમીન ઉપર બોજે હશે તો ધિરાણ કરનાર સંસ્થાની શરતો પણ બંધનકર્તા રહેશે.
- (૧૩) ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એક્ટ-૧૯૭૬ સિવાયના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ લેવા પાત્ર મંજૂરીને આધિન રહીને વિકાસ પરવાનગી આપવામાં આવશે.
- (૧૪) માર્જીનવાળા ભાગમાં પ્લોટને ફરતે એક બીજાથી ૩.૦ મીટરના અંતરે શસ્ત્ર મુજબ વૃક્ષો ઉગાડવાના રહેશે.
- (૧૫) શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૫/૨૦૧૬ ના પત્ર ક્રમાંક-પરચ-૧૦૨૦૧૦-૨૭૦૬ થી જણાવ્યા મુજબ બોરવેલ/ટયુબવેલમાં નાના બાળકો પડી જવાની દુર્ઘટનાઓ નિવારવા માટે સર્વોચ્ચ અદ્યતન નક્કી કરેલ ગાઈડ લાઈન મુજબ તકદારીના પગલા લેવાના રહેશે.
- (૧૬) આ પરવાનગીના કારણે અરજદારે માલિકી, જમીનની હદ તથા જમીન વિસ્તાર / ક્ષેત્રફળ અંગેની મંજૂરી મળતી નથી. પરંતુ બાંધકામ અંગેની મંજૂરી આપવામાં આવે છે.
- (૧૭) આ વિકાસ પરવાનગીથી ખાનગી હક્કો અંગે સત્તામંડળની કોઈપણ જવાબદારી રહેતી નથી.
- (૧૮) જમીન તથા મકાનની માલિકી, સુખાધિકારો, જમીન ઈમારતના ક્ષેત્રફળમાં દફતરે નોંધાયેલ ફેરફારો, સ્ટ્રક્ચર અંગે અહેવાલ અને રેખાંકનો, મકાનના ચાલતરમાં વપરાયેલ માલ-સામનની વિશ્વનિયતા તેમજ તેની કામગીરી પ્લાન નકશા ઉપર માલિકોની સહીઓની ચોક્કસતા અંગે સત્તામંડળની કોઈ જવાબદારી રહેશે નહિ.
- (૧૯) વખતો વખત શહેરી વિકાસ સત્તામંડળ/સરકારશ્રી તરફથી વિકાસ માટેના જે નિયમો તથા જાહેરાત કરાય તે માલિક હોત સંબંધ ધરાવતી વ્યક્તિ / સંસ્થા તેમજ અરજદારને બંધનકર્તા રહેશે.
- (૨૦) સદર વિકાસ પરવાનગી અન્વયે જમીન માલિકીમાં ફેરફાર થાય અથવા આ પરવાનગી સાથે સંકળાયેલ રજીસ્ટ્રેશન ધરાવતી વ્યક્તિ બદલાતા નવી જમીન માલિકી અંગેના પુરાવા રજૂ કરે ત્યાં સુધી તથા રજીસ્ટ્રેશન ધરાવતી વ્યક્તિની નિમણૂક નિમણૂક ન થાય ત્યાં સુધી કોમ્પ્રીહેન્સીવ જી.ડી.સી.આર.ના વિનિયમો મુજબ વિકાસ પરવાનગી વિલંબિત ગણાશે તથા સદરહું સમય દરમ્યાન બાંધકામ બિનઅધિકૃત ગણાશે.
- (૨૧) આ વિકાસ પરવાનગી પત્ર મંજૂરી આપ્યા તારખથી ૧૨-માસ સુધી જ અમલમાં રહેશે. ત્યારબાદ અધિનિયમની કલમ-૩૨ મુજબ વધારાની પુર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે.
- (૨૨) ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ ની કલમ-૩૩ મુજબ વિકાસ યોજનામાં જો કોઈ ફેરફાર થાય તો સત્તામંડળે આપેલ વિકાસ પરવાનગીમાં ફેરફાર કરી શકાશે અથવા વિકાસ પરવાનગી રદ કરી શકાશે.
- (૨૩) કોમ્પ્રીહેન્સીવ જી.ડી.સી.આર.ના વિનિયમો મુજબ અરજદારશ્રીએ ખોટી માહિતી અથવા ખોટા દસ્તાવેજ પુરાવા રજૂ કરેલ હશે તો આપેલ વિકાસ પરવાનગી આપોઆપ રદ ગણાશે.
- (૨૪) રજીસ્ટર્ડ ક્લાર્ક ઓફ વર્ક્સ / સાઈટ સુપરવાઈઝર / વિકાસ કર્તા માલિકીની બાહેધરીના પ્રમાણપત્ર પુરાવા અંગેનું રજીસ્ટ્રેશન આર્કિટેક્ટશ્રી ધ્વારા કરાવી લેવાનું રહેશે.
- (૨૫) રજૂ કરેલ ફોર્મ-૨(બી) ની વિગતો બરાબર છે. અને તેની જવાબદારી સ્ટ્રક્ચર ઈજનેર તથા આર્કિટેક્ટની રહે છે.
- (૨૬) વિકાસ પરવાનગી મેળવ્યા સિવાય કરેલ બાંધકામ બિન અધિકૃત ગણાશે. કોમ્પ્રીહેન્સીવ જી.ડી.સી.આર.ના વિનિયમ પ્રમાણે બાંધકામ કોમ્પ્રીહેન્સીવ જી.ડી.સી.આર.ના વિનિયમને આધિન દંડને પાત્ર રહેશે. જ્યારે કોમ્પ્રીહેન્સીવ જી.ડી.સી.આર.ની વિનિયમ વિરૂધ્ધ બાંધકામ અરજદારના ખર્ચે દુર કરવાનું રહેશે.
- (૨૭) સરકારશ્રીના તા.૨૮/૦૫/૨૦૦૧ ના હુકમ ક્રમાંક-પરચ/૧૦૦૨૦૦૧/૪૫૫/એલ/મુજબ વિકાસ નિયમોના સ્ટ્રક્ચરલ ડીઝાઈનના નિયમમાં ભુકંપ માટેની નેશનલ બિલ્ડીંગ કોડ તથા ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સ્પેસીફિકેશન ની જોગવાઈઓ મુજબના પ્રમાણ પત્રો, સોઈલ ટેસ્ટીંગ, સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટીના પ્રમાણપત્રોની સક્ષમ અધિકારીશ્રી ધ્વારા ચકાસણી કરી તે મુજબ અમલ કરવાનો રહેશે. સવાલવાળી જમીનમાં સોઈલ ટેસ્ટીંગ કરાવી તે મુજબની સ્ટ્રક્ચર ડીઝાઈન કરાવવાની રહેશે તથા તે પ્રમાણે સ્ટ્રક્ચરલ એન્જનીયરશ્રીની દેખરેખ હેઠળ બાંધકામ કરાવવાનું રહેશે.

ઈનવર્ડ નં. ૨૨૨, તા. ૧૮/૦૧/૨૦૧૮ (મોજે : કરમસદના રે.સ.નં. ૧૦૮૭/૨/પિકી/૨, ક્ષેત્રફળ ૫૫૧૩.૦૦ ચો.મી.)

૪

- (૨૮) ઉપર જણાવેલ શરતોનો ભંગ કરવા બદલ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૩૫, ૩૬, ૩૭, ની જોગવાઈ મુજબ દંડ તથા જરૂરી પગલાને પાત્ર થશે અને આ શરતોનો અમલ જવાબદાર ઈસમોના / સંસ્થાના ખર્ચે અને જોખમે કરાવી શકાશે અને સત્તામંડળના તેવા કૃત્યના લીધે જે નુકશાન ખોટ કે હરકત થાય તે બદલ કોઈપણ વળતર કે બદલો મળશે નહીં.
- (૨૯) જમીન માલિક/ઉવલોપર્સ ફાયર સેફ્ટીની જોગવાઈ ધારાધોરણ મુજબ કરવાની તથા કાયમ માટે તેની નિભાવણી કરવાની રહેશે.
- (૩૦) સવાલવાળી જમીનમાં ભવિષ્યમાં સોસાયટીના સભ્યો (કબજેદારો) ધ્વારા કોઈ વાદ-વિવાદ તથા કોર્ટ મેટર થાય તેની સંપૂર્ણ જવાબદારી અરજદારશ્રીની રહેશે.
- (૩૧) ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ-૨૦૧૩ તથા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ રૂલ્સ-૨૦૧૪ અને ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી રેગ્યુલેશન-૨૦૧૬ અન્વયે ફાયર સુપ્રન્ટેન્ડેન્ટશ્રી આણંદ નગરપાલિકાનો અભિપ્રાય મેળવ્યા બાદ જ જમીનનો ઉપયોગ કરવાનો રહેશે.
- (૩૨) સવાલવાળી જમીનમાં બાંધકામ શરૂ કરતા પહેલા મજુરો ધ્વારા ખુલ્લામાં શૌચક્રિયા થતી બંધ કરવા માટે મજુરો માટે હગામી ટોયલેટ બનાવવાનું ફરજિયાત રહેશે.
- (૩૩) સરકારશ્રીના તા. ૧૨/૧૦/૨૦૧૭ ના જાહેરનામાં ક્રમાંક નં. જીએચ/વી/૨૬૮ ઓફ ૨૦૧૭/ઈડીબી-૧૦૨૦૧૬-૩૬૨૯-એલ અન્વયે ૨૫% જમીન કપાત કરવા અરજદારશ્રીએ રજુ કરેલ સોગંદનામા મુજબ નકશામાં દર્શાવેલ હેચડ વાળી જમીન અવકુડા જમીન માટે ખુલ્લી રાખવાની રહેશે.
- (૩૪) ઉપર જણાવેલ કોઈપણ શરતોનો ભંગ કરવામાં આવશે તો પરવાનગી રદ થયેલી ગણાશે.

સહી/-

(ડૉ. ધવલ પટેલ)

ચેરમેન

આણંદ-વલ્લભ વિધાનગર-કરમસદ

શહેરી વિકાસ સત્તામંડળ, આણંદ

- નોંધ :- (૧) અરજદારશ્રીએ ખુટતી ચકાસણી ફી રૂ. ૧,૮૭૭/- તા. ૨૬/૧૦/૨૦૧૮ ના રોજ એચ.ડી.એફ.સી. બેન્કમાં ચલણ નં. એ-૧૧૭૫ થી ભરપાઈ કરી અસલ ચલણ અત્રે રજુ કરેલ છે.
- (૨) અરજદારશ્રીએ વૃક્ષા રોપણ ડીપોઝીટ રૂ. ૭૫/- તા. ૨૬/૧૦/૨૦૧૮ ના રોજ એચ.ડી.એફ.સી. બેન્કમાં ચલણ નં. એ-૨૮૬ થી ભરપાઈ કરી અસલ ચલણ અત્રે રજુ કરેલ છે.
- (૩) અરજદારશ્રીએ એમેનીટીઝ ચાર્જ રૂ. ૩,૨૪,૦૨૬/- તા. ૨૬/૧૦/૨૦૧૮ ના રોજ એચ.ડી.એફ.સી. બેન્કમાં ચલણ નં. એ-૦૪૮ થી ભરપાઈ કરી અસલ ચલણ અત્રે રજુ કરેલ છે.

રવાના કર્યું



મુખ્ય કારોબારી અધિકારી
આણંદ-વલ્લભ વિધાનગર-કરમસદ
શહેરી વિકાસ સત્તામંડળ, આણંદ

બિડાણ :- નકશાનો સેટ - ૨
ક્રમાંક :- એસ.આર.નં. - ૪
તારીખ :- ૦૪/૦૧/૨૦૧૮
નકલ રવાના :- ચીફ ઓફિસરશ્રી, કરમસદ નગરપાલિકા, કરમસદ, તા. જિ. આણંદ તરફ જાણ સારૂ.

આણંદ-વલ્લભ વિધાનગર-કરમસદ શહેરી વિકાસ સત્તામંડળ, આણંદ

AVKUDA

જુની પ્રાંત કચેરી, અમુલ ડેરી રોડ, તા.જિ.આણંદ-૩૮૮૦૦૧

ફોન નં.(૦૨૬૯૨) ૨૪૨૨૦૪

E mail id - avkudaand@gmail.com

નં.અવકુડા/હુકમ/વશી/

તા.

/

/૨૦૧૮

વંચાણમાં લીધા :-

- (૧) સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના હુકમ ક્રમાંક/વનમ-૩૨-૨૦૧૬-૧૮૯૭૫૮(૧)લ તથા (૨)લ તા.૦૪/૦૪/૨૦૧૬ તથા,
- (૨) સરકારશ્રીના સુધારા હુકમ ક્રમાંક વનમ-૩૨-૨૦૧૬-૧૮૯૭૫૮(૨)લ તા.૦૮/૦૫/૨૦૧૬
- (૩) ચેરમેન અને કલેક્ટરશ્રી, આણંદની તા.૨૮/૦૭/૨૦૧૬ ની સુચના.
- (૪) અત્રેની કચેરીના હુકમ નં.અવકુડા/વિ.પ/વશી/..... તા. / /૨૦૧૮

આમુખ :-


આણંદ-વલ્લભ વિધાનગર-કરમસદ શહેરી વિકાસ સત્તામંડળ માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૧૩ હેઠળ પ્રસિધ્ધ થયેલ જી.ડી.સી.આર.ને અમલ કરવા આમુખથી સુચના આપવામાં આવેલ છે.

આમુખ-(૨) થી સુચવેલ સુધારા મુજબ અત્રેથી આપવામાં આવતી વિકાસ પરવાનગીના લે-આઉટ પ્લાનમાં તથા બાંધકામની રજાચિઠીના પ્લાનમાં અવકુડા માટે ૨૦%, ૨૫%, ૩૦% તથા ૪૦% પ્રમાણે જમીન રીઝર્વેશન માટે કપાત કરીને પરવાનગી આપવામાં આવે છે. જે પરવાનગીના હુકમની શરતમાં પણ ઉલ્લેખ કરવામાં આવે છે. જેથી આવી જમીનમાં અવકુડાનું હિત જળવાઈ રહે તે માટે ગામના મહેસુલ/સીટી સર્વે રેકર્ડમાં અવકુડા માટે ૨૫% અનામત ક્ષેત્રફળની નોંધ કરવાની છે આથી રેકર્ડમાં નોંધ કરવા માટે નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.

આ સાથે આમુખ-(૪) ના હુકમની નકલ સામેલ રાખેલ છે.

હુકમ :-

મોજે : કરમસદ, તા.આણંદ, જિ.આણંદના રે.સ.નં.૧૦૮૭/૨/પૈકી/૨, ક્ષેત્રફળ ૫૫૧૩.૦૦ ચો.મી. માં આમુખ-(૪)ની પરવાનગી મુજબ રોડની કપાત ૭૨૦.૦૦ ચો.મી. + સેટબેક માર્જિનની કપાત ૩૮૩.૦૦ ચો.મી. એમ કુલ ૧૧૦૩.૦૦ ચો.મી. જમીનની નોંધ કરી તેની ફેરફાર નોંધ તથા ગા.નં.૭/૧૨ ની નકલ અવકુડા કચેરીમાં તાત્કાલિક મોકલી આપવા હુકમ કરવામાં આવે છે.



મુખ્ય કારોબારી અધિકારી
આણંદ-વલ્લભ વિધાનગર-કરમસદ
શહેરી વિકાસ સત્તામંડળ, આણંદ

પ્રતિ,

(૧) મામલતદારશ્રી, આણંદ (ગ્રામ્ય),

૨/ હુકમ મુજબ રેકર્ડમાં અમલવારી કરવા તથા અનામત જમીનનું ગા.નં.૮/અ માં અવકુડાના નામે અલગ ખાતું કરવા જરૂરી કાર્યવાહી કરી સંબંધિત ફેરફાર નોંધ તથા ગા.નં.૭/૧૨ અને ૮/અ ની નકલ સત્વરે મોકલી આપવા સારૂ.

જયભારત નકલ રવાના :-

પ્રાંત અધિકારીશ્રી, આણંદ, તા.જિ.આણંદ તરફ જાણ તથા કાર્યવાહી થવા સારૂ.

જયભારત નકલ રવાના :-

જિલ્લા નીરીક્ષકશ્રી, જમીન દફતર, જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ તરફ જાણ તથા કાર્યવાહી સારૂ.

જયભારત નકલ રવાના :-

શ્રી જયેશકુમાર જશભાઈ પટેલ, ઠે.૩/જી, વૈભવ કોર્મશીયલ સેન્ટર, ગ્રીડ પાસે, મુ.પોઆણંદ, તા.જિ.આણંદ તરફ જાણ સારૂ.



Raghukul
BUILDERS

204, Maruti Skand,
Anand-Vidyanagar Road,
Anand - 388 001, Gujarat, INDIA

Ph : 87587 70007, 93772 56715
Email : raghukulbuilder@yahoo.com
Web : raghukulbuilders.com

DATE : 19TH JUNE ,2019

TO WHOM IT MAY CONCERN

SUB: Cancellation of booking Of Raghukul Paavan Shop No.11.

I, **Puransingh Ramsingh Rathore** Proprietor Of **Raghukul Builder** hereby declare that I had received the pre-booking of Raghukul Paavan Shop No.11- from the allottee having a Name: **Bhanwarlal Jodha Gurjar**. Allottee has Paid amount in Rs.1,70,000/- though cheque No.000001 (Bank of Baroda) on 12th September ,2018 and subsequent instalment was received on 24th October,2018 for amount in Rs.1,30,000/- through cheque No.000002 (Bank OF Baroda).

Due to Non-Availability of RERA-Registration I cancelled the said Booking and Refunded the Said amount through the AXIS BANK A/C No.-917020086573859 having a cheque No.001531 on 19th june,2019 in the Name of Bhanwarlal Jodha Gurjar.

Both of the parties has agreed and accepted the same having no objection for with this regards.

Yours Faithfully

For, Allottee

Handwritten signature of Bhanwarlal Jodha Gurjar

Yours Faithfully

For , Raghukul Builder

RAGHUKUL BUILDER
Handwritten signature of Puransingh Ramsingh Rathore
PROPRIETOR